

વસીમ ખરીદી કરવા જાય છે

   IndiSciCovid

by Indian Scientists Response to Covid

<https://indscicov.in/>

Illustrations by: Suneha Mohanty



વસીમ એકદમ ઝબકી ને ઉંઘ માંથી ઉઠ્યો - "અરે, આજે અજિત સરના ક્લાસ છે... આજે ફરી મોડો પોહંચીશ. હવે તો સર તો મને ફાઇનલ પરીક્ષા માં બેસવા જ નહીં દે. અલ્લાહ મારી ખૈર કરજો"

આ ટેન્શનમાં વસીમની ઉંઘ ઉડી ગઈ પણ એને તરત યાદ આવ્યું કે "હમણાં તો લોકડાઉનના કારણે કોલેજ તો બંધ છે. હાશા! હજી થોડી વાર સુવા મળશે" એમ વિચારીને વસીમે પાસું ફેરવ્યું. પણ બહારના રૂમમાં બધા ઉઠી ગયા હતા અને ઘણી ચહલ-પહલ ચાલી રહી હતી. વસીમની અમ્મી નસીમ, સવારની ચા બનાવી રહી હતી અને દાદીમાનું ગૂંથવાનું કામ ચાલુ થઈ ગયું હતું. વસીમના પિતા અબ્દુલ નમાઝ કરી રહ્યા હતા. "ચાલો, હવે આપણે પણ ઉઠી જઈએ, આમે હવે ઉંઘ નહિ આવે" વસીમ ઉંઘ ખંખેરી આઠસ મરડી ઉભો થયો.

બ્રશ કરતા કરતા વસીમને એની હોસ્ટેલ યાદ આવી ગઈ. કેવી મજાની, સ્વતંત્ર જિંદગી હતી. વસીમનો મિત્ર દિલીપ એની સાથે રૂમમાં રહેતો. એમનો હોસ્ટેલનો રૂમ અહીંના ઘરથી મોટો હતો. મિત્રો સાથે રહેવાનું, ભણવાનું અને અસંખ્ય ચાના કપ પર રાજનીતિની મજેદાર ચર્ચા કરવાની. ખરેખર મસ્ત બેફિકર જિંદગી હતી. ત્યાં અચાનક લોકડાઉન જાહેર થયું એટલે બે અઢવાળિયા પેહલાજ કોલેજ બંધ થઈ ગઈ અને બધા વિદ્યાર્થીને પોતપોતાના ઘરે જવાનું કેહવામાં આવ્યું. ઘરે પોહંચવા માટે વસીમને બે ટ્રેન બદલાવવી પડી અને એ પછી ત્રણ કલાક જીપની સવારી કરી તે માંડ માંડ ઘરે પોહંચ્યો. જ્યારે ઘરે પોહંચ્યો ત્યારે જ બધાને રાહત થઈ.



"વસીમ, જરા જલ્દી કર. મને માર્કેટથી ચિકન અને ટમેટાં જોઈએ છે. જલ્દી જા નહીતો દુકાન બંધ થઈ જશે. અને જો માસ્ક પહેરીને જ જવાનું છે અને કોઈ સાથે રસ્તા માં હાથ ના મિલાવતો, કોઈ વસ્તુને હાથ ના લગાવતો અને લોકોથી દૂર જ રહેજે - સોશિયલ ડિસ્ટન્સ પાડજે " અમમીનું સૂચનાનું લિસ્ટ ચાલુ થઈ ગયું.

"અને મારી બ્લડ પ્રેશરની દવા પણ ખલાસ થઈ છે. દુકાનમાં પૂછતો આવજેકે એમની પાસે સ્ટોક આવી ગયો કે નહિ? અંદરથી દાદીમાં બૂમ પાડીને બોલ્યાં.

"ઓહો! બધું કામ મારે જ કરવાનું? મારે જ ખરીદી કરવા બહાર જવાનું? આજે હું બધું કામ કરી આવીશ પણ પછી બે દિવસ ઘરની બહાર નહી જાઉં. એટલે હમણાં જ લાવવાનું છે તેનું લિસ્ટ આપી દેજો" વસીમે જરા ચિડાઈને કહ્યું.

"વસીમ બેટા, મારા માટે છાપું તો લઈ આવીશ ને? બને તો આવતી કાલ નું પણ લઈ આવજે !" બાબા એ હસતા હસતા કહ્યું. આ સાંભળી ઘર માં બધાંજ હસી પડ્યાં. બાબાના રમુજી સ્વભાવથી વાતાવરણ હંમેશા હળવું થઈ જતું.


વસીમની મોટી બેહન અંજુમ દુબઈ રહેતી એટલે રોજ રાત્રે ફોન કરતી અને નવી નવી બાતમી અને સૂચનાઓ આપતી. અંજુમે વસીમને કહી રાખેલું કે "બહાર જઈ ખરીદીનું કામ ફક્ત વસીમે જ કરવું જોઈએ કારણ કે બાકી બધાં મોટી ઉંમરના છે એટલે એમણે ઘરની બહાર ના જવું જોઈએ. આમે, વસીમને ઘરે બીજું કામ તો છે નહિ એટલે બહારની ખરીદી કરીને મદદરૂપ થઈ શકે. અને અંજુમે ખાસ કહ્યુંતું કે માસ્ક પહેરીયા સિવાય ઘરની બહાર જવું નહિ."



અમ્મી અને અંજુમની સૂચના યાદ કરી, બાબાએ અમ્મીના જુના દુપટાનું માસ્ક બનાવેલું તે વસીમે પેહરી લીધું. અમ્મીએ વસીમને શાલ પેહરીને જવાનું કહું પણ વસીમે સરાસર ના પાડી અને સમજાવતા કહ્યું "અમ્મી, બહાર બહુ ગરમી છે, એટલે શાલ નહીં પેહરી શકાય ઘરે આવીને આ માસ્ક ધોઈ નાખીશ" અને સ્લીપર પેહરી, શોપિંગ બેગ લઈ, વસીમ ઘરની બહાર નીકળી ગયો.

વસીમે પહેલાં દવાની દુકાનની લાંબી લાઈનમાં ઉભું રહેવું પડ્યું. દુકાનની બહાર ચોકથી ચકરડા કરેલા તેના ઉપર ઉભી પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો. એ તો સારું થયું કે એના મોબાઇલમાં બેલેન્સ હતું એટલે દોસ્તો સાથે ગપ્પા મારી સમય વિતાવી શક્યો.

દવા ખરીદી ને વસીમ કરીમ ચાચાની ચિકન ની દુકાને પોહ્યો. કરીમ ચાચા એક તો વાતોડિયા અને આજે દુકાનમાં ગઈ ન હતી એટલે વસીમને જોઈને ખુશ થઈ ગયા. ચાચા આરામથી ચિકનસાફ કરી રહ્યા હતા. એટલે એમને અંદરથીજ વસીમ સાથે ગપ્પા મારવાનું ચાલુ કરી દીધું "આવ બેટા વસીમ! ઘરે બધા ઠીક તો છે ને? આ લોકડાઉન ક્યારે ખતમ થશે? તારા ફોન પરતો બધા સમાચાર આવતા હશેને ? કોઈ નવી બાતમી છે? હોય તો મને જણાવ" કરીમ ચાચાની કોમેન્ટરી સાંભળી વસીમને સારું લાગ્યું. રોજ દોસ્તો સાથે વાત કરી શકશે પણ આજે ચાચા સાથે પ્રત્યક્ષ વાત કરવાની મજાજ અલગ છે, એટલે તેને ફોન બંધ કરી ચાચા સાથે વાત ચાલુ કરી" ના, ચાચા કોઈ નવી ખબર નથી. કોણ જાણે લોકડાઉન ક્યારે ખતમ થશે? લાગે છે હજુ લાંબુ ચાલશે. ત્યાં સુધી આપણા દેશની ઈકોનોમીની તો વાટ જ લાગી જશે" આ રીતે થોડી ચર્ચા કરી વસીમ ચિકન લઈને ઘર જવા નીકળી ગયો.



વસીમ ઘરે પોંહચીયો તો અમ્મીએ દરવાજા પાસે એક મગમાં સાબુનું પાણી અને સાફ કપડું રાખેલું. વસીમે સ્ત્રીપર ઉતારી, હાથ ધોયા અને સાબુના પાણીથી દવાનું બોક્સ સાફ કર્યું. અમ્મીએ બાજુમાં એક રૂમાલ અને સેનિટાઈઝરની બોટલ પણ રાખી હતી તેનાથી વસીમે પોતાનો મોબઇલ સાફ કર્યો. બે દિવસ પહેલાંજ અમ્મીએ સમજાવ્યું હતું કે મોબાઇલ સાફ કરવો જરૂરી છે નહિતો મોબાઇલ વાપરવા નહિ મળે.

આ બધું કરીને પછીજ વસીમ ઘર ની અંદર આવ્યો અને અમ્મીને ચિકન અને ટામેટાં આપ્યા. અમ્મીએ ફરી ચિકન અને ટામેટાં પાણીથી ધોઈ, એકદમ સ્વચ્છ કરી અને ફ્રિજમાં ગોઠવી દીધા. ત્યાં સુધી વસીમ નાઈ -ધોઈને આવી ગયો અને એણે પોતાના કપડાં અને માસ્ક ધોઈ ને સુકવી દીધા.



દાદીને બહારનો ચેપ ના લાગવો જોઈએ એ વિચારીને વસીમે દાદીની દવા બોક્સમાંથી કાઢી, દવાના ડબ્બામાં વ્યવસ્થિત રાખી દીધી અને બોક્સ કચરાના ડબ્બામાં ફેકી દીધું અને વળી પાછું એક વાર હાથ સાબુથી ધોઈને પછી દવાનો ડબ્બો દાદી પાસે લઈ ગયો. "આ લ્યો દાદી, તમારી દવા. ગઈ કાલે સ્ટોક આવી ગયેલો " વસીમે દાદીને દવાનો ડબ્બો આપતાં આપતા કહ્યું.

વસીમની નજર હવે અબ્બા પર ગઈ અને એને એકદમ યાદ આવ્યું "અરે, અબ્બા માટે છાપું લાવતાં તો ભૂલીજ ગયો! કઈ વાંધો નહિ, હવે એના કારણે અબ્બાના રમુજી ટુચકા તો સાંભળવા મળશે".

આ લાક્ષણિક દૃશ્યો દર્શાવવા અને અમે પૂરી પાડેલી માહિતી ને સંદર્ભિત કરવા માટે છે. આવશ્યકપણે, આ વાત ને સરળ બનાવે છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે વૈજ્ઞાનિક ચોકસાઈ માટે વેબસાઇટ પરના દસ્તાવેજો ને જોવો

